

# Review Questions

નિઃસ્પૃહતા :

૪/13/2018

- (૧) — એ જ્યાં નિઃસ્પૃહ બને તો જ નિલેપતા આવે
- (૨) — મુનિને આત્મસ્વભાવમાં રહેવાની પણ સ્પૃહા હોવી જોઈ.
- (૩) — આત્મતત્ત્વની લગાની લાગણી હો તો જ્યાં કોઈ કોઈ વખત પોદ્ગામિક સુખોને વૃદ્ધાની જેમ ઠોડી દે છે.
- (૪) — અજ્ઞાની જ્યાં પોતે માનેલી સુખ સામગ્રી મેળવવા માટે બિખારીની જેમ ભરકે છે તો પણ ધરાતો નથી.
- (૫) — સ્પૃહા કેવી છે? ગૌરવશાળી માહાત્મને પણ તેલકા માહાત્મનો દાસ બનાવે છે.
- (૬) — સ્પૃહાના મુખ્ય ત્રણ રૂપ છે. દીનતા, નિઃસ્પૃહતા અને મુદ્દા.
- (૭) — આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાની વચ્ચે દેવા પછી દુઃખ સ્વશંકું પણ નથી.
- (૮) — આત્મરતિમાંથી પ્રગટેલી સ્પૃહા ઉપાદેય છે.
- (૯) — સ્પૃહાવાળા જ્યાં તેલકા હોવા છતાં સંસારરૂપ સમુદ્દમાં ડુબે છે.
- (૧૦) — સિદ્ધગુણવાસી મુનિ નિઃસ્પૃહી હોવા છતાં કોઈ પાસે ભોગ સુખની માગણી તરીકે પોતાના
- (૧૧) — અધાઠામુતિ મુનિ પાસે શારીરનો પર્યાય બદલવાની શક્તિ હતી.
- (૧૨) — નિઃસ્પૃહી મુનિને યશની સ્વરૂપી દેહ રક્ષા હોવી જોઈ.
- (૧૩) — સ્પૃહારહિત મુનિને અકુલત્વ વેળું સુખ લાગે છે.
- (૧૪) — પરદેહની વચ્ચે તરીકે તો જ માતું દુઃખ છે.